

ટીએસપી-આઈસીએઆર યોજના અંતર્ગત ખેડૂત શિબિર તથા કીટવિતરણનો કાર્યક્રમ દેડીયાપાડા ખાતે યોજાયો

જૈવિક નિયંત્રણ વિભાગ, ઓર્નિથોલોજી વિભાગ અને માઈક્રોન્યુટ્રીયન્ટ વિભાગ, આઈસીએઆર, યુનિટ-૯, આકૃત્યુ, આણંદ ના સંયુક્ત ઉપક્રમે ટ્રાઈબલ સબ પ્લાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર તથા કીટવિતરણનો કાર્યક્રમ તા. ૦૪/૧૦/૨૦૧૮ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નર્મદા-દેડીયાપાડા ખાતે ગોઠવવામાં આવેલ. જેમાં નર્મદા જીલ્લાના કુલ ૭૦ ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ. આ ખેડૂત શિબિરમાં પાક સંરક્ષણમાં જૈવિક નિયંત્રકોનો ઉપયોગ, પક્ષીઓની ઉપયોગીતા તથા સુક્ષ્મ તત્ત્વોનું પાક ઉત્પાદનમાં મહત્વ જેવા વિષયો પર જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત ખેડૂતોને પાક સંરક્ષણમાં ઉપયોગી થઈ શકે તે મુજબ બાયોપેસ્ટીસાઈડ, ફેરોમોન ટ્રેપ અને પીળા ચીકણા ટ્રેપ તથા પક્ષીઓના સંરક્ષણ માટે માળા અને જૈવિક ખાતરનું વિતરણ કરવામાં આવ્યું.

માનનીય ડૉ. એચ. આર. પટેલ, સહસંશોધક નિયામક અને યુનિટ અધિકારીશ્રી, આકૃત્યુ, આણંદના માર્ગદર્શન હેઠળ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ. તેઓએ ખેડૂતોને જૈવિક નિયંત્રણ, પક્ષીઓની ઉપયોગીતા તથા સુક્ષ્મ તત્ત્વો અંગેની માહિતી આપેલ. સદર ખેડૂત શિબિરમાં જૈવિક નિયંત્રણ વિભાગના ડૉ. ડી. એમ. મહેતા, ડૉ. રઘુનંદન બી. એલ. અને ડૉ. મયંક પટેલ; ઓર્નિથોલોજી વિભાગના ડૉ. સી. કે. બોરડ અને ડૉ. જી. જી. દુલેરા તેમજ માઈક્રોન્યુટ્રીયન્ટ વિભાગના ડૉ. વી. પી. રામાણી અને ડૉ. રવી પટેલ એ ઉપરોક્ત વિષયો પર વ્યાખ્યાન રજૂ કર્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સુબધ્ધ રીતે સંચાલન ડૉ. હીતેશ જાદવ, એસએમએસ, કેવીકે (પાક સંરક્ષણ), દેડીયાપાડા અને ડૉ. નેહાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.

કેવીકે-નર્મદા દેડીયાપડા ખાતે ટીએસપી-આઈસીએઆર યોજના અંતર્ગત ખેડૂત શિબિર



ડૉ. રધુનંદન બી. એલ. દ્વારા ટીએસપી યોજના વિષેની માહિતી

ડૉ. મયંક પટેલ દ્વારા પાક સંરક્ષણમાં જૈવિક નિયંત્રકોના ઉપયોગ વિષય પર વિસ્તૃત ચર્ચા



ડૉ. જી. જી. દુલેરા દ્વારા પાક સંરક્ષણમાં પક્ષીઓની ઉપયોગીતા વિષય પર વ્યાખ્યાન

ડૉ. રવી પટેલ દ્વારા ખેડૂતોને માઈક્રોન્યૂટ્રીયન્ટની પાક ઉત્પાદનમાં અગત્યતા વિષય પર ચર્ચા



કીટવિતરણ

શિબિરમાં ભાગ લેનાર ખેડૂતો અને વૈજ્ઞાનિકો



કીટવિતરણ